

# રાજકોટ મહાનગરપાલિકા

ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી :-

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા DAY-NULM યોજના હેઠળ કાર્યરત સખી મંડળો તથા NULM સ્ટાફ માટે યોજાયેલ સેમીનારમાં મનપા દ્વારા બનાવવામાં આવેલ સ્વ સહાય જૂથ (SHG)ના ૭૦થી વધુ બહેનો ઉપસ્થિત રહેલ

તારીખ: ૨૧-૦૫-૨૦૨૨

દીનદયાળ અંત્યોદય યોજના -રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન DAY-NULM યોજના અંતર્ગત સામજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ (SM&ID) યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં કાર્યરત સ્વ સહાય જૂથના બહેનો માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટને સરકારી સબસિડી માટેની યોજના માટે 19 મે ગુરુવારના રોજ રાજકોટ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝ યોજના હેઠળ 10 લાખ સુધીની સબસિડી તથા સ્વ સહાય જૂથના સભ્યને 40 ,000 સુધીની મળવા પાત્ર લોન તેમજ ગુજરાત રાજ્યમાં હાલમાં કાર્યરત ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ગૃહ ઉદ્યોગ તેમજ નાના પ્રોસેસિંગ યુનિટોને આ યોજનાની સહાય દ્વારા વધુ સારી અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ થાય અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજનાની માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની સાથોસાથ રસ ધરાવનાર વ્યક્તિને એક જ સ્થાન પર બધા જ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ યોજના અંતર્ગત નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટોને અપગ્રેડ કરવા માટે તેમજ નવું યુનિટ શરૂ કરવા માટે પ્રોજેક્ટ ખર્ચની ૩૫ ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સિવાય પણ અનેક પ્રકારની સુવિધાઓ આ યોજના અંતર્ગત આપવામાં આવી રહી હતા. જે બાબતથી માહિતગાર કરવામાં આવેલ હતા.

આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શ્રી કે.વી.મોરી, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી આર.વી.કપુરિયા, બાગાયત અધિકારી શ્રી જી.જી.કાતરિયા , સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના રિજિયોનલ અધિકારી શ્રી વિનીત કુમાર , ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના આસિસ્ટન્ટ મેનેજર શ્રી પીનલબેન પટેલ, સૌરાષ્ટ્ર વેપારી મહામંડળના પ્રમુખ શ્રી પરાગભાઈ તેજુરા , પ્રગતિશીલ ખેડુત શ્રી રમેશભાઈ રુપારેલિયા તથા અભ્યુદય ભારત પ્રોજેક્ટના શ્રી ધવલ રાવલ ઉપસ્થિત રહીને સૌને વિવિધ યોજનાઓથી માહિતીગાર કર્યા હતા. તથા આ યોજના અંતર્ગત શરૂ કરી શકાય તેવી વિવિધ પ્રોડક્ટ વિષે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારનું આયોજન અભ્યુદય સંસ્થા દ્વારા

કરવામાં આવેલ જેમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ના પ્રતિનિધિઓ ડો.પ્રશાંત જોશી તથા મોનિકાબેન ભોઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

આ સેમિનારમાં રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન( DAY-NULM) યોજનાનાં સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ (SM&ID) ઘટક હેઠળ રાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ સ્વ સહાય જૂથ (SHG) ના ૭૦ થી વધુ બહેનો અને NULM મેનેજરો તથા NULM સમાજ સંગઠકો ઉપસ્થિત રહ્યા હતા.